

78 78 5 91 0 92 પર GK લખી વોટ્સેપ પર સેન્ડ કરો.

**Current affairs 358 (1) સામાન્ય જ્ઞાન 11-2-2017**

**Page-1**

## રાષ્ટ્રીય

૧) કેન્દ્ર સરકાર આવનાર બે વર્ષમાં પ્રાયોગિક ધોરણે દુરંતો ટ્રેનમાં ડોક્ટરોની નિમણૂક કરશે.

૨) જાહેર વિતરણ વ્યવસ્થા (પી.ડી.એસ.) માં કાળા બજાર અને ગેરમાર્ગે જતા રાશનને રોકવા માટે સસ્તા અનાજના કાર્ડ સાથે સરકારે આધાર કાર્ડ જોડવાની કામગીરી આરંભી છે, આગામી જુન સુધીમાં આધાર કાર્ડ નહિ જોડાય તેનું રાશન બંધ જ કરવામાં આવશે.

૩) ભારતની નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીને આંતરરાષ્ટ્રીય આંતકવાદી સંગઠન આઈ.એસ.કિલ લીસ્ટમાં 150 ભારતીય આઈ.ટી.પ્રોફેશનલ્સની યાદી મળેલ છે.

૪) ગુજરાત રાજ્ય સાર્વજનિક વિતરણ પ્રણાલીને ડીજીટલ બનવાર દેશનું પ્રથમ રાજ્ય બનેલ છે.

૫) ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ 10 ફેબ્રુઆરી 1952 ના રોજ લોકસભા માટે પ્રથમ ચૂંટણી યોજાઈ હતી.

૬) હાલમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન દ્વારા તમામ યુનિવર્સિટીઓ અને ટેકનીકલ સંસ્થાઓએ તાકીદ કરવામાં આવી છે કે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કોર્સ દર ત્રણ વર્ષે બદલા અથવા તેમાં વખતો-વખત નવા સુધારાઓ કરવા.

૭) 10 ફેબ્રુઆરીના રોજ દેશભરમાં નેશનલ ડીવર્મિંગ ડે (ફૂમિનાશક) ઉજવવામાં આવેલ.

## આંતરરાષ્ટ્રીય

૮) ભારતીય મૂળના બે મહિલા અવકાશ યાત્રીઓ બાદ ડોક્ટર શાવના પંડ્યા અંતરીક્ષમાં જનાર ત્રીજા ભારતીય મહિલા અવકાશ યાત્રી બનશે.

૯) ડોક્ટર શાવના કેનેડાના અલ્બર્ટા યુનિવર્સિટીની હોસ્પિટલમાં ન્યુરો સર્જન છે.

11-2-2017

૧૦) હાલમાં તાતા સ્ટીલ દ્વારા તેના સ્પેશીયલીટી સ્ટીલ બિજનેસને લીબર્ટી હાઉસ ગ્રુપને 10 કરોડ પાઉન્ડમાં વેંચવા માટે ડીફીનીટીવ વેંચાણ કરાર કરેલ છે.

૧૧) તાજેતરમાં પાકિસ્તાન દ્વારા અરબી સમુદ્રમાં યુદ્ધ અભ્યાસ આરંભવામાં આવેલ છે, તેમાં અમેરિકા, રશિયા અને બીજા ઘણા દેશો મળીને 36 જેટલા યુદ્ધ જહાજો જોડાશે.

૧૨) હાલ પાકિસ્તાનના વાઈસ એડમિરલ તરીકે સૈયદ અરિફુલ્લાહ હુસૈની ફરજ બજાવી રહ્યા છે.

### રમત-જગત

૧૩) હાલમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વિકેટ કીપર અને બેટ્સમેન એવા સરફરાઝ અહેમદને વન-ડે ક્રિકેટ ટીમના નવા સુકાની તરીકે પસંદ કરેલ છે.

૧૪) ક્રિકેટ મેચની એક જ સિઝનમાં 1000 રન પુરા કરનાર ખેલાડી તરીકે વિરાટ કોહલી પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે. તેણે હવે આ રેકોર્ડ પોતાના નામે કરેલ છે.

૧૫) અમેરિકાના પૂર્વ નંબર વન ગોલ્ડર ખેલાડી ટાઈગર વુડ્સ ઘૂંટણમાં સર્જરી કરાવી દોઢ વર્ષ બાદ ગોલ્ફ રમવા માટે તૈયાર થઈ ગયા છે.

૧૬) તાજેતરમાં જાપાને ફેડ કપમાં ભારતને 3-0 થી પરાજય આપેલ છે.

૧૭) હાલમાં ચેતશ્વર પુજારાએ એક જ સત્રમાં ચંદુ બોરડેનો સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ તોડેલ છે.

### અન્ય

૧૮) ભારત અને સેનેગલ વચ્ચે સ્વાસ્થ્ય અને ચિકિત્સા ક્ષેત્રે આઠ જેટલા કરાર કરવામાં આવેલ છે.

૧૯) ભારતના દિલ્લી શહેરમાં ફિક્કીનું મુખ્ય કાર્યાલય સ્થિત છે.

૨૦) કેન્દ્ર સરકારે 56 પોસ્ટ ઓફિસોમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલવાની જાહેરાત કરેલ છે.

11-2-2017

## સમીક્ષા 195 (1) તારીખ 11/2/2017

### ગુજરાત પી.ડી.એસ.ને કૈશલેસ બનાવનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું...

- ૧) દેશમાં ગુજરાત એવું પ્રથમ રાજ્ય બનેલ છે કે જેણે સાર્વજનિક વિતરણ પ્રણાલી અંતર્ગત રાશનની દુકાન સંપૂર્ણ પાણે કૈશલેસ બની છે.
- ૨) આ સિવાય રેલ્વે, વિમાન તથા જીવન વીમા પોલીસી પણ ડીજીટલ રીતે ચૂકવાય તેવું નક્કી કરી દેવામાં આવેલ છે.
- ૩) દેશના કેન્દ્રીય ખાદ્ય મંત્રી રામ વિલાસ પાસવાન દ્વારા આ માહિતી આપવામાં આવેલ છે.
- ૪) તેમના દ્વારા જણાવવામાં આવેલ છે ,કે આગામી માર્ચ સુધીમાં તમામ દુકાનો પર આ સુવિધા ઉપલબ્ધ હશે.
- ૫) આ યોજના અનુસાર આધાર કાર્ડને આ પ્રણાલી સાથે જોડી દેવામાં આવશે.
- ૬) ગુજરાત સરકારે રાજ્યની 17,250 સરકારી માન્યતા પ્રાપ્ત દુકાનોને આધાર કાર્ડ આધારિત ચુકવણી પ્રણાલીથી સજ્જ કરેલ છે.
- ૭) રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આ રીતે એસ.ટી.પાસ તથા અન્ય સેવાઓને જોડવાનો આગ્રહ કરેલ છે.

– પરેશ ચાવડા

11-2-2017

રોજે- રોજ આપના ફોનમાં જુકે, કરંટ અફેર્સ મેળવવા નીચેની લીંક પરથી એપ ડાઉનલોડ કરો.

<https://play.google.com/store/apps/details?id=com.edusafar>

વિડીયો ઘોરણ 10 પ્રકરણ 16 ના મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન વિડીયો જુઓ નીચેની લિંક પરથી

<https://www.youtube.com/watch?v=GnE-1kMhEB0>

ગણિત સાદું વ્યાજ વિડીયો ભાગ ચાર.માટે નીચેની લિંક ઓપન કરો.

<https://www.youtube.com/watch?v=v9uCYOeeN6A>

1 થી 2 ફેબ્રુઆરી કરંટ અફેર્સનો ગુજરાતી વિડીયો નીચેની લિંક પરથી જુઓ

<https://www.youtube.com/watch?v=3xUiTgR3bQw>

બેસ્ટ જુકે વિડીયો માટે નીચેની લીંક ઓપન કરો.

[https://www.youtube.com/channel/UCfDAM9P2RF\\_ynz8B\\_j5enC](https://www.youtube.com/channel/UCfDAM9P2RF_ynz8B_j5enC)

મિત્રો, એજ્યુસફર દ્વારા **GK** ના વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે આ માટે **YouTube** પર જઈ, **EduSafar** લખી સર્ચ કરી, ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી **GK** વિડીયો ના નવા અપડેટ્સ મેઈલ પર મળતા રહેશે.